

Psa

Chapter 93

Gujarati Interlinear

Reference: American Standard Version

בִּלְ-תִּכְבֹּד תִּכְוֶן אֶת-הַתְּאֵדָה עֲלֵי יְהוָה לְבָשׁ לְבָשׁ גְּאוֹת מְלִכָה יְהוָה 1
નહી જગત સ્થિર-છે બરેબર બાંધ્યું-છે સામર્થ્ય યહોવાએ પહેરી-છે પહેરી-છે મહાનતા રાજ-કરે-છે યહોવા
[H1077](#) [H8398](#) [H0637](#) [H0247](#) [H5797](#) [H3068](#) [H3847](#) [H3847](#) [H1348](#) [H3068](#)
:תְּמוֹנֹת
□ןש
[H4131](#)

Jehovah reigneth; he is clothed with majesty; Jehovah is clothed with strength; he hath girded himself therewith: The world also is established, that it cannot be moved.

אֶתְּהָ: מְעוֹלָם מֵאָז כִּסְאֶךָ נִכְוֶן 2
તું-છે અનાદિકાલથી પ્રાચીન-કાલથી તારું-સિંહાસન સ્થિર-છે
[H5769](#) [H3678](#)

Thy throne is established of old: Thou art from everlasting.

דְּבָרִים: נִהְרֹת יִשְׁאוּ קוֹלָם נִהְרֹת נִשְׁאוּ יְהוָה וְנִהְרֹת נִשְׁאוּ 3
તેમનાં-મોજાં નદીઓએ ઊંચકી તેમનો-અવાજ નદીઓએ ઊંચકી યહોવા નદીઓએ ઊંચકી
[H1796](#) [H5104](#) [H5375](#) [H5104](#) [H5375](#) [H3068](#) [H5104](#) [H5375](#)

The floods have lifted up, O Jehovah, The floods have lifted up their voice; The floods lift up their waves.

יְהוָה: בְּמַרְוֹם אֲדָר מַיּוֹם מְשַׁבְּרֵי-יָם אֲדָרִים רַבִּים מַיּוֹם וּמִקְלֹת אֲוַחֵי-כֶסֶף 4
યહોવા ઊંચામાં ઊંચા-છે સમુદ્રના સમુદ્રના-મોજાં શક્તિશાળી પુષ્કળ પાણીઓનાં અવાજો-કરતાં
[H3068](#) [H4791](#) [H0117](#) [H3220](#) [H4867](#) [H0117](#) [H4325](#)

Above the voices of many waters, The mighty breakers of the sea, Jehovah on high is mighty.

יָמִים: לְאֶרֶץ לְיְהוָה קִדְשׁ נִצָּנְתָּ-לְבֵיתֶךָ מֵאָז נֶאֱמַנְוּ וְיָרִיעַ 5
દિવસો-સુધી સદાકાલ-માટે યહોવા પવિત્રતા શોભે-છે તારા-ઘરને ઘણી વિશ્વાસપાત્ર-છે તારી-સાક્ષીઓ
[H3117](#) [H0753](#) [H3068](#) [H6944](#) [H4998](#) [H3966](#) [H0539](#)

Thy testimonies are very sure: Holiness becometh thy house, O Jehovah, for evermore.